

કલમ-૪(૧) (બી) (૦૨) અધિકારી / કર્મચારીઓની હોદ્દાદીઠ ફરજ અંગેની ટુંકી વિગત

મધ્યસ્થ કચેરીમાં ફરજ બજાવતાં ત્રીજા વર્ગના કર્મચારીઓની કામગીરીની વિગત

| અ.નં. | કર્મચારીનો હોદ્દો | ફરજની ટુંકી વિગત |
|--|---------------------------|---|
| ૧ | ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી | ૧. મધ્યસ્થ કચેરીને લગતી મહત્વની ખાતાકીય કામગીરીનું સંચાલન કરવું. |
| | | ૨. પ્રથમશ્રેણી કલાર્ક સુધીના પગારના ઈજાફા મંજૂર કરવા. તેમજ રજા મંજૂર કરવી. |
| | | ૩. ખાતાને લગતી પરચુરણ ખરીદી કરવા અંગેના રૂા. ૧૦૦૦/- સુધીના બીલો મંજૂર કરવા. |
| | | ૪. જાહેર સભ્યો, વેપારીઓ, ઈજારદારો, સરકારી અને અન્ય બીન સરકારી સંસ્થાઓ સાથે ખાતાકીય બાબતે પત્રવ્યવહાર કરવો. |
| | | ૫. તાબા હેઠળના કર્મચારીઓના ખાનગી અહેવાલ તૈયાર કરવા અંગેની કામગીરી. |
| | | ૬. રૂા. ૫૦,૦૦૦/- સુધીના જનરલ એડવાન્સ ખાતે ઉપાડેલ રકમનું રીકુપમેન્ટ મંજૂર કરવા અંગેની કામગીરી તથા ખાતાના પગારના બીલો / ટી.એ.ડી.એ. ના બીલો / એલ.ટી.સી. ના બીલો મંજૂર કરવા અંગેની કામગીરી. |
| | | ૭. ડીઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી. |
| | | ૮. ડી.પી. ઓર્ડરની કામગીરી |
| | | ૯. બોર્ડ / સ્ટેન્ડીંગ મીટીંગમાં હાજર રહેવું. |
| | | ૨ |
| ૨ જનરલ એડવાન્સ, એસ.ડી./ઈ.એમ.ડી. તથા ટી.એ.ડી.એ. નું રજી., નિભાવણીની કામગીરીની દેખરેખ કરવી. | | |
| ૩ વહીવટી અહેવાલ તૈયાર કરવો તથા છપાવવો તથા ઓડીટ અહેવાલની કામગીરી. | | |
| ૪ એસ્ટાબ્લીશમેન્ટ તથા પ્રોસીક્યુશનની કામગીરી. | | |
| ૫ પ્રથમ શ્રેણી કલાર્ક સુધીના કર્મચારીની રજા તથા ઈજાફા મંજૂર કરવાની કામગીરી. | | |
| ૬ વિવિધ ખાતા / ઝોનની રોજબરોજની ફ્રેન્કીંગ ટપાલો ફ્રેન્ક કરવા અંગેની કામગીરી તથા તે સંલગ્ન ફ્રેન્કીંગ મશીન ઉત્પાદક કંપની તથા પોસ્ટ ખાતા સાથે જરૂરી પત્રવ્યવહાર કામગીરી. | | |
| ૭ રેકર્ડની જાળવણી તથા વર્ગીકરણની કામગીરી. | | |
| ૮ સેક્શન ઓફિસરશ્રીની સત્તામાં આવતા બીલો મંજૂર કરવાની કામગીરી. | | |
| ૯ જાહેર જનતાની અરજીઓ અંગે સંબંધિત ખાતા તેમજ ઝોન વાઈઝ શેરા મારવા. | | |
| ૧૦ તાબા હેઠળના પ્રથમ શ્રેણી કલાર્ક, સીનીયર કલાર્ક તેમજ ત્રીજી શ્રેણી કલાર્કની કામગીરી પર દેખરેખ તથા જરૂર જણાયે કામગીરી વહેંચણીની વ્યવસ્થા કરવી. | | |
| ૧૧ મે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ધ્વારા સુચવવામાં / સોંપવામાં આવતી કામગીરી. | | |
| ૩ | હેડ કલાર્ક | ૧ ટ્યુશન ફી ચૂકવવાની કામગીરી, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ પ્રિપેરેશન પ્લાનને લગતી કામગીરી, નાગરિક અધિકાર પત્ર તૈયાર કરવાની કામગીરી, સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, સરકારશ્રી તરફથી માંગવામાં આવતી માહિતીનું સંકલન. |
| | | ૨ કમિશનરશ્રીના પરિપત્ર મુજબ જુદા જુદા ખાતામાંથી મંજૂરી અર્થે રજૂ કરવામાં આવતી દરખાસ્તનો એકત્રિત રીપોર્ટ તૈયાર કરી સેક્રેટરી વિભાગમાં મોકલવા અંગેની કામગીરી તથા સેક્શન ઓફિસરશ્રીની રજા દરમ્યાન તેમની તમામ કામગીરી સંભાળવી તેમજ તાબા હેઠળના સીની.કલાર્ક તેમજ ત્રીજીશ્રેણી કલાર્કની કામગીરી ઉપર દેખરેખ તથા જરૂર જણાયે કામગીરીની વહેંચણી / વ્યવસ્થા કરવી. |
| | | ૩ આર.ટી.આઈ. ની કામગીરી. |
| | | ૪ હાજરીપત્રકની કામગીરી. |
| | | ૫. મીનીટસની કાર્યવાહી કરવી. |
| ૪ | સીની. કલાર્ક | ૧ સામાન્ય સભામાં સભ્યશ્રીઓ તરફથી પુછવામાં આવતા પ્રશ્નો અંગે તથા સુચનો અંગે સંબંધિત ખાતામાંથી જવાબ મેળવી ફાઈલ તૈયાર કરવાની કામગીરી. |
| | | ૨ સ્થાયી સમિતિની મીટીંગ દરમ્યાન રજૂ થતા સુચનો અંગે સંબંધિત ખાતા પાસેથી કોમ્પલાયન્સ રીપોર્ટ મેળવવાની કામગીરી. |
| | | ૩ કમિ.શ્રી તરફથી હેલ્થ એન્ડ એન્જી., અંગે લેવામાં આવતી મીટીંગો તથા અન્ય મીટીંગોની કાર્યવાહીની નોંધ તૈયાર કરવાની કામગીરી. |
| | | ૪ ત્રીજી શ્રેણી કલાર્કની કામગીરી પર દેખરેખ તથા જરૂર જણાયે કામગીરીની વહેંચણી / વ્યવસ્થા કરવી. |
| | | ૫ મધ્યસ્થ કચેરીમાં ફાળવવામાં આવેલ તમામ કોમ્પ્યુટર સીસ્ટમની જાળવણી, રજીસ્ટર, નિભાવવા અંગેની કામગીરી. |
| | | ૬ સુ.મ.પા. ના બજેટ બોર્ડમાં રજૂ થતા સુચનો / રજૂઆતો અંગેની નોંધ તૈયાર કરવા અંગેની કામગીરી. |

| | | | |
|---|----------------------|----|--|
| | | ૭ | એસ્ટાબ્લીશમેન્ટ તથા પ્રોસીક્યુસન કામગીરી. |
| | | ૮ | સુ.મ.પા. ભરતી અંગેની જાહેરાત સમયે અરજીઓની સ્વીકૃતિ તેમજ એસ.ઓ.(આર)શ્રી ને પહોચાડવા અંગેની તમામ આનુસાંગિક વ્યવસ્થા કરવી. |
| | | ૯ | પર્સનલ એડવાન્સ, ટી.એ.ડી.એ. રજીસ્ટર નિભાવવાની કામગીરી, જનરલ એડવાન્સ, એસ.ડી. / ઇ.એમ.ડી. સંલગ્ન તમામ કાર્યવાહી તેમજ તે સંલગ્ન જરૂરી રજીસ્ટર નિભાવવાની કામગીરી. |
| | | ૧૦ | મ્યુ. સભ્યશ્રીઓના ગ્રાન્ટ તથા અન્યો પત્રો નોંધવાની કામગીરી. |
| | | ૧૧ | પ્રતિ વર્ષ વહીવટી અહેવાલ, ઓડીટ અહેવાલ છપામણી તેમજ પ્રસિધ્ધ કરવા સીની. કલાર્ક સાથે સંકલનમાં રહી તમામ આનુસાંગિક કાર્યવાહી પુર્ણ કરી તૈયાર કરવાની કામગીરી. |
| | | ૧૨ | નાગરીક અધિકારપત્ર અન્વયેની મળતી અરજીઓ તથા તેના નિકાલ અંગેની ખાતા / ઝોનની માહિતી એકત્રિત કરી સરકારશ્રીમાં મોકલવાની કામગીરી. |
| | | ૧૩ | સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના બાળકોની ટયુશન ફી / સત્ર ફી રીઈમબર્સ ની કામગીરી તથા ૭૩-ડી અન્વયે ઝોન / ખાતામાંથી આવતી વિગતોએ જરૂરી વિવિધ સમિતિ વાઈઝ સંકલિત કરી દરખાસ્ત તૈયાર કરી સેક્રેટરી વિભાગમાં મોકલવા અંગેની કામગીરી. |
| | | ૧૪ | પર્સનલ એડવાન્સ, ટી.એ.ડી.એ. રજીસ્ટર નિભાવવાની કામગીરી, જનરલ એડવાન્સ, એસ.ડી., ઇ.એમ.ડી. રજીસ્ટર નિભાવવાની કામગીરી, વહીવટી અહેવાલ તૈયાર કરવો તથા છપાવવો તથા ઓડીટ અહેવાલની કામગીરી તેમજ મ્યુ. સભ્યશ્રીઓના ગ્રાન્ટ તથા અન્ય પત્રો નોંધવાની કામગીરી. તેમજ આર.ટી.આઈ. ની કામગીરી કરવી. (APIO) સીની.કલાર્કને મદદ કરવી. |
| | | ૧૫ | પ્રતિ વર્ષ ફ્લેગ ડે ઉજવણી અન્ય ઝોન / ખાતામાંથી લક્ષ્યાંક મુજબની રકમ એકત્ર કરી કલેક્ટર ઓફિસમાં જમા કરાવવા અંગેની કામગીરી.સીની.કલાર્કને મદદ કરવી. |
| | | ૧૬ | કમિશનરશ્રીના પરિપત્ર મુજબ જુદા જુદા ખાતામાંથી મંજૂરી અર્થે રજૂ કરવામાં આવતી દરખાસ્તો એકત્રિત કરી રીપોર્ટ તૈયાર કરી સેક્રેટરી વિભાગમાં મોકલવાની કામગીરી. |
| | | ૧૭ | વિવિધ ઝોન / ખાતામાંથી સેક્રેટરીશ્રી પ્રતિ મોકલવામાં આવતી દરખાસ્તો ફાઈલ સહી કરાવી નોંધ અનુસાર નોંધ કરી અત્રેથી ખાતામાં મોકલવાની તથા સમિતિવાઈઝ મીટીંગમાં સેક્રેટરીમાંથી અત્રે સંબંધિત ખાતા / ઝોનમાં મોકલવાની કામગીરી. |
| | | ૧૮ | સ્થાયી સમિતિની મીટીંગ સંલગ્ન એજન્ડા સહિતની મીટીંગ ફાઈલ તૈયાર કરવાની કામગીરી. |
| | | ૧૯ | ફેક્સ કરવા તથા મોકલવા અંગેની કામગીરી. |
| | | ૨૦ | સરકારી / અર્ધસરકારી વિગેરે આવતા પત્રો રજીસ્ટરમાં નોંધ કરવાની કામગીરી તથા જાહેર જનતા તરફથી આવતા પત્રો / ફરીયાદની નોંધણી કરવાની કામગીરી. |
| | | ૨૧ | મે. કમિ.શ્રીમાં જુદા જુદા ખાતા ધ્વારા મુકવામાં આવતા બાઈન્ડરોની નોંધણી તેમજ સહી થઈને આવતા બાન્ડરો જુદા જુદા વિભાગોમાં પરત મોકલવાની કામગીરી. |
| | | ૨૨ | જરૂરીયાત મુજબની જરૂરી સ્ટેશનરી તથા ઓફિસ સામગ્રીની ખરીદી. |
| ૫ | ત્રીજી શ્રેણી કલાર્ક | ૧ | મેયર્સ ફંડ અંગેના પત્રવ્યવહાર |
| | | ૨ | ફ્રેન્ડીંગ મશીન, ફેક્સ મશીન તથા ઝેરોક્ષ મશીનોનો વાર્ષિક કોન્ટ્રાક્ટ રેઈટથી કરવા તથા રીપેરીંગ કરાવવા અંગેની કામગીરી. |
| | | ૩ | પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત સ્વૈચ્છિક સંસ્થાઓની અધ્યાવત યાદી તૈયાર કરવાની કામગીરી તથા સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મીટીંગ યોજવા અંગેની તમામ આનુષાંગિક કાર્યવાહી. |
| | | ૪ | ડેડ સ્ટોક રજીસ્ટર નિભાવણી અંગેની કામગીરી. |
| | | ૫ | મધ્યસ્થ કચેરીના તમામ પત્રો વિગેરે ટાઈપ અંગેની કામગીરી તેમજ ઓફિસ સુપ્રિ.શ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી. |
| | | ૬ | વિવિધ ખાતા / ઝોનની રોજબરોજ ફ્રેન્ડીંગની ટપાલો ફ્રેન્ક કરવા અંગેની કામગીરી તથા તે સંલગ્ન ફ્રેન્ડીંગ મશીન ઉત્પાદક કંપની તથા પોસ્ટ ખાતા સાથેના જરૂરી પત્ર વ્યવહારની કામગીરી. |
| | | ૭ | ૨૬ મી જાન્યુઆરી તથા ૧૫ મી ઓગષ્ટના ઉજવણી અંગેનો જરૂરી સુચનાઓ જારી કરતો પરિપત્ર જારી કરાવવા અંગેની કામગીરી. |
| | | ૮ | મધ્યસ્થ ફ્લેડ કંટ્રોલ રૂમ શરૂ કરવા અંગેની કામગીરી તથા તે સંબંધિત જરૂરી હુકમ જારી કરવા, પ્રિ-મોન્સુન પ્રતિવર્ષ ડી.એમ.પી. પુસ્તિકા તૈયાર કરી પ્રસિધ્ધ કરવાની કામગીરી. |
| | | ૯ | કર્મચારીઓના બાળકોના વિવિધ સ્કોલરશીપ એનાયત કરવા અંગેની કામગીરી. |
| | | ૧૦ | સરકારશ્રીમાંથી આવતા પત્રો સરકારશ્રીમાં મોકલવાની માહિતી વિગતો સંદર્ભે ખાતા / ઝોન સંકલનની કામગીરી તથા પત્ર વ્યવહારની કામગીરી. |

| | | |
|--|-----|---|
| | ૧૧ | વિશીષ્ટ કામગીરી તથા પ્રસંશાપત્રો એનાયત કરવાની આનુસાંગિક કામગીરી. |
| | ૧૨ | મેયરશ્રી, ડે. મેયરશ્રી, સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રી, વિવિધ સમિતિઓના સદસ્યશ્રી, ઓડીટરશ્રીના પત્રો, કોર્ટ સમન્સ, વિભાગીય વડાશ્રીઓ તરફથી મોકલવામાં આવતા પત્રો / નોંધ સંલગ્ન કામગીરી. |
| | ૧૩ | પોલીસી મેટરને લગતી જે તે વિભાગોની ફાઇલ તૈયાર કરવી તથા જાળવવી તથા રજીસ્ટર નિભાવવાની કામગીરી. |
| | ૧૪ | ડી.પી. ઓર્ડરની ફાઇલોની જાળવણી તથા રજીસ્ટર નિભાવવાની કામગીરી. |
| | ૧૫ | મેયરશ્રી, ડે. મેયરશ્રી, સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રી, વિવિધ સમિતિઓના સદસ્યશ્રી, ઓડીટરશ્રીના પત્રો, કોર્ટ સમન્સ, વિભાગીય વડાશ્રીઓ તરફથી મોકલવામાં આવતા પત્રો / નોંધ રજીસ્ટરમાં નોંધ કરી તે સંલગ્ન કામગીરી. |
| | ૧૬ | તમામ ઝોન / તથા (સેન્ટ્રલ ઝોન) સીવાય મ.ધ.હો., સ્મીમ્બેર કોલેજ અને હોસ્પિટલ, સ્લમ અપગ્રેડેશન સેલ, ડ્રેનેજ ખાતુ, તથા ટ્રાફિક સેલની અન્ય ખાતા ઝોનની ટપાલો સ્વીકારી જરૂરી નોંધ રજીસ્ટરમાં નોંધ કરી જે તે દિવસે સંબંધિત ખાતા / ઝોનમાં મોકલવાની કામગીરી. |
| | ૧૭ | જી તથા જી-૧ રજીસ્ટર (સરકારશ્રી તરફથી તેમજ અન્ય સરકારી ખાતામાંથી પત્રો) ની નોંધણી કરી સંબંધિત ખાતા / ઝોનને તેમજ જાહેર જનતા ધ્વારા કમિશનરશ્રીને ઉદ્દેશીને આવતા પત્રો / ફરીયાદની જરૂરી નોંધણી કરવાની તેમજ સંબંધિત ખાતા / ઝોનને મોકલવાની કામગીરી. |
| | ૧૮ | એસ્ટબ્લીશમેન્ટ, પ્રોસીક્યુશનને લગતી તમામ આનુષાંગિક કામગીરી. |
| | ૧૯ | ડી-રજીસ્ટર (જાહેર જનતામાંથી આવતી ટપાલો) સી.એચ. રજીસ્ટર (હાઈકોર્ટ મેટર, ડી.એફ. રજીસ્ટર) તથા જુદી જુદી જગ્યાઓ ભરવા માટે આવતી અરજીઓની નોંધ રજીસ્ટરમાં જરૂરી નોંધણી કરી એસ.ઓ.શ્રી (આર) માં નિયત સમયે પહોંચતી કરવી. |
| | ૨૦. | વખતો વખત ઓ.એસ.શ્રી તથા એસ.ઓ.શ્રી ધ્વારા આપવામાં આવતી કામગીરી હાથ ધરવી. |
| | ૨૧. | તમામ વિભાગીય વડાશ્રીઓની ઓફિસમાં ઉપયોગમાં આવતી સ્ટેશનરીની ફાળવણી કરવી. |
| | ૨૨. | સેન્ટ્રલ સ્ટોર તથા આઈ.એસ.ડી. વિભાગમાં ઈન્ડોર ભરી સ્ટેશનરી મેળવી તથા તની જાળવણી તથા મેઈન્ટેન કરવાની કામગીરી. |

કલમ-૪(૧) (બી) (૦૨) અધિકારી / કર્મચારીઓની હોદ્દાદીઠ ફરજ અંગેની ટુંકી વિગત

કમ્પ્લેઈન મેનેજમેન્ટ એન્ડ એનાલીસીસ સેલમાં ફરજ બજાવતાં ત્રીજા વર્ગના કર્મચારીઓની કામગીરીની વિગત

| અ.નં. | કર્મચારીનો હોદ્દો | | ફરજની ટુંકી વિગત |
|-------|---------------------------|----|--|
| ૧ | ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી | ૧. | કમ્પ્લેઈન મેનેજમેન્ટ એન્ડ એનાલીસીસ સેલની ને લગતી મહત્વની કામગીરીનું સંચાલન કરવું. |
| | | ૨. | ખાતામાં ફરજ બજાવતા પ્રથમ શ્રેણી કલાર્ક સુધીના પગારના ઈજાફા મંજૂર કરવા. |
| | | ૩. | ખાતાને લગતી પરચુરણ ખરીદી કરવા અંગેના રૂા. ૧૦૦૦/- સુધીના બીલો મંજૂર કરવા. |
| | | ૪. | જાહેર જનતા અને અન્ય ખાતા વિભાગ/ઝોન સાથેના કમ્પ્લેઈન તેને સંબંધિત બાબતે પત્રવ્યવહાર કરવો. |
| | | ૫. | તાબા હેઠળના કર્મચારીઓના ખાનગી અહેવાલ તૈયાર કરવા અંગેની કામગીરી. |
| ૨ | પ્રથમ શ્રેણી કલાર્ક | ૧ | તા.કલાર્ક, પટાવાળા તેમજ બેલદાર સુધીની કર્મચારીની રજા ખતવણી કરવાની કામગીરી. |
| | | ૨ | જુદા જુદા ખાતા/ઝોનમાં કમ્પ્લેઈન કેટેગરી અને સબ કેટેગરી મુજબ ઝોન/વિભાગ માંથી મોકલવામાં આવતી એસાઈની ઓફીસરોના નામ અને મોબાઈલ નંબર ની વિગતો કમ્પ્લેઈન મેનેજમેન્ટ સીસ્ટમમાં અપડેટ કરવી. . |
| | | ૩ | દરેક નાણાકીય વર્ષ ને અંતે ખાતાનો વહીવટી અહેવાલ તૈયાર કરવો . |
| | | ૪ | રેકૉર્ડની જાળવણી તથા વર્ગીકરણની કામગીરી. |
| | | ૫ | તાબા હેઠળના સીનીયર કલાર્ક તેમજ તા.કલાર્ક ની કામગીરી પર દેખરેખ તથા જરૂર જણાયે કામગીરી વહેંચણીની વ્યવસ્થા કરવી. |
| | | ૬ | આર.ટી.આઈ. ની કામગીરી. |
| | | ૭ | મે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ધ્વારા સુચવવામાં / સોંપવામાં આવતી કામગીરી. |
| | | ૮ | જે એસાઈની ઓફીસરની ફરિયાદ વધારે સંખ્યામાં હોય તેમજ એક માસ થી વધુ સમય દરમ્યાન પડતર હોય તેમને નિકાલ કરવા માટે ટેલીફોન મારફત જાણ કરવાની કામગીરી . |
| ૩ | સીની. કલાર્ક | ૧ | કમ્પ્લેઈન મેનેજમેન્ટ સીસ્ટમમાં જાહેર જનતા તરફથી હેલ્પલાઈન/કોલ સેન્ટર પર, વોટસ એપ મારફત, વેબ સાઈટ મારફત તેમજ મોબાઈલ એપ્લીકેશન મારફત કરવામાં આવતી અધરની કેટેગરીની ફરિયાદ સંબંધિત ઝોન/ખાતા પ્રતિ તબદીલ કરવામાંની કામગીરી. |
| | | ૨ | આર.ટી.આઈ. ની કામગીરી. |
| | | ૩ | ત્રીજી શ્રેણી કલાર્કની કામગીરી પર દેખરેખ તથા જરૂર જણાયે કામગીરીની વહેંચણી / વ્યવસ્થા કરવી. |
| ૫ | ત્રીજી શ્રેણી કલાર્ક | ૧ | સુરત મહાનગરપાલિકાના કોલ સેન્ટર/ટોલ ફ્રી નંબર તેમજ વોટસ એપ નંબર પર જાહેર જનતા મારફત કરવામાં કમ્પ્લેઈન કમ્પ્લેઈન મેનેજમેન્ટ સીસ્ટમમાં ઈનપુટ કરીને કમ્પ્લેઈન આઈ.ડી.નંબર SMS મારફત મોકલવાની કામગીરી. |
| | | ૨ | કમ્પ્લેઈન મેનેજમેન્ટ સીસ્ટમ ના તમામ પત્રો વિગેરે ટાઈપ અંગેની કામગીરી તેમજ ઓફિસ સુપ્રિ.શ્રી, પ્રથમ શ્રેણી કલાર્ક તેમજ સીની.કલાર્ક તરફથી સોંપવામાં આવતી કામગીરી. |
| | | ૩ | ઈનવર્ડ અને આઉટવર્ડ રજીસ્ટર નિભાવવા અને ટપાલ સંબંધિત ખાતા/ઝોન પ્રતિ મોકલવાની કામગીરી. અન્ય ખાતા ઝોનની ટપાલો સ્વીકારી જરૂરી નોંધ રજીસ્ટરમાં નોંધ કરી જે તે દિવસે સંબંધિત ખાતા / ઝોનમાં મોકલવાની કામગીરી |
| | | | |

મધ્યસ્થ કચેરી વર્ષ-૨૦૨૩

અધિકારી/કર્મચારીઓની માહિતી દર્શાવતું પત્રક તા.૩૧/૦૩/૨૦૨૩

| અ.નં. | અધિકારી/કર્મચારીનું નામ તથા કર્મચારી નંબર | હોદ્દો | સરનામું તથા ફોન નંબર/મોબાઈલ નંબર | રિમાર્ક્સ |
|-------|---|---------------------|--|-----------|
| 1 | શ્રી ઝવેરભાઈ સી.પટેલ- ૩૪૦૪૨ | પ્રિ.પ્રા.સેક્રેટરી | ૭ નેસ્ટ વેનેજીઆ,કેનાલ રોડ,અલથાણ જી.સુરત-૩૯૫૦૧૭, મો.૯૭૨૪૩ ૪૫૫૫૪ | |
| 2 | શ્રી પ્રવીણકુમાર.આર.પ્રસાદ- ૩૪૯૩૫ | એકઝી આસી. | ૨૦૧-બી, ૧૯/૨, ગ્રીનસીટી, પાલભાઠા રોડ, સુરત - ૩૯૩૪૧૫ ,મો.૯૭૨૪૩ ૪૫૪૯૩ | |
| 3 | શ્રી મેહુલકુમાર એસ.પટેલ- ૩૬૨૪૮ | એકઝી.આસી. | ૨૯/બી, ક્રિષ્ણાનગર સોસાયટી-૨, ગુજરાત ગેસ સર્કલ પાસે, રાંદેરરોડ, સુરત, મો.૯૭૨૪૩ ૪૫૪૯૮ | |
| 4 | શ્રી હેમાંગીનીબહેન કે. ચૌહાણ- ૩૭૪૯૦ | આસી.ઈજનેર | ૧૪૪,સંઘ્યાવંદન સોસાયટી,પાલનપુર પાટીયા,મીની વીરપુર રોડ,સુરત-૩૯૫૦૦૯, મો.૯૬૬૪૯ ૭૯૨૬૯ | |
| 5 | શ્રીવિક્રમ સી. ચૌધરી-૩૭૫૯૩ | આસી.ઈજનેર | ૧૦૧-પહેલો માળ,પ્લોટ નં. ૭૧-૭૨, કૃષ્ણકુંજ એપા., સર્વોદય નગર,ઉધના,સુરત મો.૭૮૭૪૫ ૮૦૬૧૧ | |
| 6 | શ્રી હેમાંગીની પી. ઠાકોર- ૧૦૮૧૨ | ઓ.એસ. | એ ૨૦૩, અક્ષ હોમ્સ, ભાગ્યલક્ષ્મી સોસા.ની સામે, મધુરમ ડેરીની સામે,પીપલોદ,સુરત-૩૯૫૦૦૩ મો- ૮૧૪૧૪ ૧૨૭૦૭, ૯૮૨૫૨ ૪૦૩૧૪ | |
| 7 | શ્રી યુ.એમ.જાદવ-૧ ૧૯૩૨ | એસ.ઓ. | ૬૩, હરસિદ્ધિ સોસાયટી,જૂનો કોસાડ રોડ, અમરોલી,સુરત. મો.૯૯૨૫૧ ૫૫૧૦૪ | |
| 8 | શ્રી ફાલ્ગુનીબેન આર. મેહતા- ૧૨૪૭૦ | હેડ કલાર્ક | એ-૧૦૨ સુમેર રેસીડન્સી,અડાજણ,પાલ, મણીભદ્ર રેસીડન્સીની બાજુમાં,સુરત મો.૮૮૪૯૧ ૦૭૬૩૨ | |
| 9 | શ્રી અલ્પેશકુમાર પી.ચૌહાણ- ૪૨૨૪૫ | સ્ટે.-II | ૨, શાંતિવન રો હાઉસ, ગેઈલ ટાવરની સામે, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત. મો. ૯૯૨૪૬ ૧૫૭૪૫, ૭૨૨૮૦ ૨૦૪૩૨ | |
| 10 | શ્રીમતી તેજલબેન આર.સારંગ- ૪૨૨૫૦ | સ્ટે.-II | ૧/૭૫૮,જૂની પારસી ધર્મશાળાની પાછળ, બારવાવાડ, નાનપુરા, સુરત. મો.૮૩૨૦૧ ૫૪૧૨૬ | |
| 11 | શ્રી પ્રમોદ આર. બોરસે- ૧૭૯૯૩ | સીની. કલાર્ક | ૧૨૨-મારૂતિધામ સોસા.,જૂનો કોસાડ રોડ, રેલ્વે લાઈન,અમરોલી,સુરત-૩૯૪૧૦૭ મો.૯૯૨૪૩ ૯૪૫૧૪ | |
| 12 | શ્રી મો.ફૈયાઝ એ.ગાડીવાલા- ૩૫૧૬૩ | સીની કલાર્ક | પ્લોટ નં.૧૧, અમન સોસાયટી વિભાગ-૩, જીવન જ્યોત સિનેમાની પાછળ, સુરત.મો.૯૯૨૪૭ ૩૨૩૯૭ | |
| 13 | શ્રી નિમેષ જી.નાયક-૩૬૪૦૭ | સીની કલાર્ક | ૧૧૧, વિશાલ કો- ઓપ, હાઉસિંગ સોસા, ભટાર ચાર રસ્તા પાસે, ઉધના- મગદલ્લા રોડ, ભટાર, સુરત- ૩૯૫૦૦૧ , મો.૯૯૯૯૭ ૧૯૯૯૭ | |
| 14 | શ્રી ગુણવંતભાઈ જે. પટેલ- ૩૬૪૧૦ | સીની કલાર્ક | ૯, જલારામ નગર, કરંજ રોડ,તા.ઓલપાડ જિ.સુરત.- ૩૯૪૫૪૦ , મો.૯૯૨૫૭ ૭૨૫૨૩ | |
| 15 | શ્રી રોકેશકુમાર.એસ. મહાગાંવકર - ૪૨૮૮૫ | સીની કલાર્ક | ૧૯,મુલાનંદનગર,ઘેલખડી રોડ,નવસારી -૩૯૬૪૪૫ મો.૯૩૭૪૫ ૧૧૮૭૬ | |
| 16 | શ્રી યશવંતભાઈ.આર.સોલંકી- ૧૯૧૮૦ | કલાર્ક-III | મુ. પો:વેલંજા,પ્રાથમિક શાળાની બાજુમાં,તા.કામરેજ,જી.સુરત-૩૯૪૧૫૦ મો.૮૩૨૦૫ ૬૧૮૯૮ | |
| 17 | શ્રી ધનેશ એમ.ચૌહાણ-૪૩૧૮૨ | કલાર્ક-III | ૦૫, તપસ નગર સોસાયટી, મીની વીરપુર મંદિર પાસે, પાલનપુર નહેર રોડ, સુરત.મો.૯૯૧ ૩૩ ૩૨૫૫૫ | |

| | | | |
|----|--|------------|--|
| 18 | શ્રી વિમલકુમાર બી.પટેલ- ૩૬૩૪૫ | કલાર્ક-III | ૧૪૩, રાધેપાર્ક સુભાષ ગાર્ડન પાસે, દાંડી રોડ, રાંદેર, સુરત. મો. ૯૮૭૯૦ ૨૭૪૦૦ |
| 19 | શ્રી ધવલકુમાર સી. જરીવાળા- ૪૭૩૮૫ | કલાર્ક-III | ૯/૩૬૭-બી, ચકાવાલા ની શેરી, વાડીફળીયા, સુરત-૩૯૫૦૦૩ મો. ૮૧૪૦૨ ૦૨૦૬૭ |
| 20 | શ્રી મો. સોહેલ બી. મીરજા- ૪૭૩૮૬ | કલાર્ક-III | ૧૨/૧૫૩૮, ૨૦૨, હિદાયત પેલેસ, પટની હોલની સામે, બ્રહ્મપોળ, શાહપોર, સુરત-૩૯૫૦૦૩ મો. ૮૭૫૮૨ ૬૫૩૪૪ |
| 21 | શ્રી દિપીકા ડી. પટેલ-૪૭૩૮૭ | કલાર્ક-III | ૧૦૫/બી, ઈચ્છાનગર સોસાયટી, જહાંગીરપુરા, સુરત, મો. ૯૭૨૫૮ ૬૪૫૮૭ |
| 22 | શ્રી પ્રિતેશકુમાર બી. દરજી- ૪૭૩૮૮ | કલાર્ક-III | ૭૭, હરીનગર-૩, બી. આર. સી. ગેટની સામે, ઉધના - સુરત. મો. ૯૮૭૯૯ ૨૫૮૮૭ |
| 23 | શ્રી ખ્યાતિ એસ. સુરતી- ૪૭૩૮૯ | કલાર્ક-III | એ/૭, મહાવીર રો હાઉસ, હનીપાર્ક રોડ, અડાજણ, સુરત, મો. ૯૯૨૪૦ ૪૧૭૧૧ |
| 24 | શ્રી ભૂમિ એન. ચૌહાણ-૪૭૩૯૦ | કલાર્ક-III | ૦૭, વિશ્વકર્મા સોસાયટી, રામનગર, રાંદેરરોડ, સુરત. મો. ૯૭૨૭૦ ૫૭૪૭૮ |
| 25 | શ્રી ભાવિનીબહેન એચ. ગાંધી- ૪૭૩૯૧ | કલાર્ક-III | ૫૦, પુનિતનગર સોસાયટી, વિજયડેરી નજીક, પાલનપુર પાટિયા, સુરત, મો. ૯૦૩૩૯ ૪૯૬૪૮ |
| 26 | શ્રી હર્ષ બી. શેઠ-૪૭૩૯૨ | કલાર્ક-III | ઈ-૪૦૨, ગ્રીન એન્કલેવ એપાર્ટમેન્ટ, સરદારપુલની નજીક, અડાજણ, સુરત, મો. ૯૮૭૯૪ ૪૫૬૧૩ |
| 27 | શ્રી મનીષ ડી. પટેલ-૪૭૬૫૭ | કલાર્ક-III | ૨૬૮, ઓમ બંગ્લોઝ, માસ્ટરની વાડી, અમરોલી રોડ, સુરત.-૩૯૫૦૦૫ મો. ૯૮૨૫૭ ૨૬૭૯૭ |
| 28 | શ્રી યોગિનીબેન સી. ઢીમર- ૪૭૭૯૧ | કલાર્ક-III | ૫૦-૩૫૯ સોસાયટી, મરાઠી સ્કુલ પાસે, વેડરોડ, સુરત-મો. ૮૪૬૦૬ ૫૭૧૭૪ |
| 29 | શ્રી અમીત જી. સોલંકી- ૪૭૭૯૩ | કલાર્ક-III | સી-૩૦૨, શ્રીપદ સીઝન્સ, ન્યુ ગૌરવપથ રોડ, પાલનપુર, સુરત-૩૯૫૦૦૯ મો. ૭૦૪૩૫ ૫૮૮૮૪ |
| 30 | શ્રી ભાવનાબહેન એન. માર્ટીન- ૪૭૯૨૧ | કલાર્ક-III | ઈ ૩૦૪, વનીતા પાર્ક એપાર્ટ. આર્શીવાદ પેલેસ ની પાછળ, ભટાર રોડ, સુરત. ૩૯૫૦૧૭ મો.- ૮૪૬૯૮ ૯૪૦૧૦ |
| 31 | શ્રી નિકિતાબેન આર. પટેલ- ૪૮૦૬૦ | કલાર્ક-III | નગરશેઠની વાડી, મોરાભાગળ ચાર રસ્તા, રાંદેર, સુરત. ૮૨૩૮૯ ૦૬૪૬૪ |
| 32 | શ્રી અંજનાબેન એ. પટેલ- ૪૮૦૬૧ | કલાર્ક-III | એ/૪૦, ન્યુ. સૌરભ સોસાયટી, એચ. પી. પેટ્રોલપંપની સામે, મોરાભાગળ, રાંદેર, સુરત. મો. ૯૭૨૫૨ ૭૩૩૯૫ |
| 33 | શ્રી હાર્દિક સુકેશકુમાર ભલ્લ- ૪૮૦૬૨ | કલાર્ક-III | એફ/૪૦૩, રાજહંસરેસીડન્સી, સુભાષ ગાર્ડનની પાછળ, જહાંગીરપુરા, સુરત. મો. ૯૫૫૮૮ ૦૬૭૧૩ |
| 34 | શ્રી સનિલ નરેશભાઈ કાનફટે- ૪૮૦૬૩ | કલાર્ક-III | ૫૮૦, જલારામનગર સોસાયટી, ગણેશપુરા, અમરોલી, સુરત. ૮૧૪૧૬ ૩૬૩૫૫ |
| 35 | શ્રી જયેશકુમાર એમ. મકવાણા- ૪૮૦૬૪ | કલાર્ક-III | એ-૬, પહેલો માળ, સરસ્વતી સોસા, ગેટ નં. ૧, શારદા વિદ્યાલયની સામે, કોઝવે, સીંગણપોર-૩૯૫૦૦૪ મો. ૯૪૨૬૦ ૩૨૩૬૪ |
| 36 | શ્રી સાગર એ. ઢીમર-૪૮૬૯૮ | કલાર્ક-III | ૧૨/૨૩૩૩, માછીવાડ, સૈયદપુરા, સુરત. મો. ૭૩૮૩૩ ૬૯૬૫૯ |
| 37 | શ્રી કૃતિકા એ. શેડગે-૪૮૭૭૩ | કલાર્ક-III | ઈ- ૫૦૨, નીલ કંઠ રેસીડન્સી, રાજવડની સામે, ન્યુ એલ. પી. સવાણી સ્કુલ રોડ, પાલનપુર કેનાલ રોડ, જકાતનાકા, સુરત. મો. ૯૯૨૫૭ ૯૮૦૩૨ |
| 38 | શ્રી તોરલબહેન એ. પટેલ- ૪૮૯૨૯ | કલાર્ક-III | ૨૦૩, નૈતિક રેસીડન્સી, એલ. પી. સવાણી ચાર રસ્તા પાસે, હનીપાર્ક રોડ, સુરત. મો. ૬૩૫૫૨ ૧૪૫૯૨ |
| 39 | શ્રી અંકિતા વી. શાહ-૪૯૨૦૬ | કલાર્ક-III | ૮૦૧, નવપદ એપાર્ટ., આશુતોષ હોસ્પિ. ની સામે, સગરામપુરા, મજુરાગેટ, સુરત.- ૩૯૫૦૦૨ મો. ૯૪૨૭૫ ૭૬૪૭૨ |

| | | | |
|----|--------------------------------------|------------|--|
| 40 | શ્રી દીપાબેન એમ.નાઈ-૪૯૨૨૨ | કલાર્ક-III | ૧૫૦, જલારામ સોસા.-૩, મોડેલ ટાઉન પાસે, પરવત પાટીયા, સુરત - ૩૯૫૦૧૦ મો.૯૫૩૭૬ ૭૯૯૫૧ |
| 41 | શ્રી મયુરકુમાર એન.પટેલ- ૪૯૩૦૩ | કલાર્ક-III | ૨૦૭, માધવબાગ સોસાયટી, રાજહારમોની ની બાજુમાં, ઉગત કેનાલ રોડ, સુરત.-૩૯૫૦૦૫ મો.૮૭૫૮૪ ૦૧૦૮૮ |
| 42 | શ્રી સુનિલ એસ.સપકાળ-૧૨૦૨૮ | પટાવાળા | ૯૭, કૃષ્ણનગર સોસાયટી, જુનો કોસાડ રોડ, અમરોલી, સુરત મો.૯૮૭૯૫ ૭૧૯૪૫ |
| 43 | શ્રી કમલેશ બી.જાદવ-૧૨૬૩૧ | પટાવાળા | ૩૦૩, ત્રીજોમાળ મ્યુ.સ્ટાફ ક્વાર્ટસ ક્ષેત્ર પાલ આરોગ્ય કેન્દ્ર, સગરામપુરા, સુરત. મો.૯૪૨૯૦ ૧૩૫૩૧ |
| 44 | શ્રી અમૃત એન.પટેલ-૧૩૮૩૫ | પટાવાળા | મહાદેવનગર-૪, પ્લોટ નં.એ/૩૧ ઉધના, નવાગામ ડીડોલી, સુરત મો.૯૯૭૪૨ ૧૭૬૩૫ |
| 45 | શ્રી કમલેશકુમાર.એન.પાવાગઢી -૧૩૮૫૬ | પટાવાળા | ૪૧, વિજયનગર સોસા. પ્રભુનગરની બાજુમાં, કતારગામ દરવાજા, સુરત મો.૯૯૧૩૬ ૫૯૪૪૬ |
| 46 | શ્રી શંકર જી રાઠોડ-૧૩૮૫૯ | પટાવાળા | મુ.પો. સોસક, તા.ઓલપાડ, જિ.સુરત. મો.૯૮૭૯૫ ૯૪૪૦૭ |
| 47 | શ્રી હરીશચંદ્ર બી.પટેલ-૧૩૯૦૧ | પટાવાળા | બી-૨૨ પ્રભુ દર્શન સોસા, ઉગત નહેર, મોરાભાગળ ચાર રસ્તા ઉગત ગામ સુરત. ૩૯૫૦૦૫ મો.૯૩૨૮૯ ૦૯૫૯૬ |
| 48 | શ્રી શંશીકાંત એમ પટેલ- ૧૪૪૧૩ | પટાવાળા | મુ.પો.સોસક, (નવુ ફળિયુ) તા.ઓલપાડ, જિ.સુરત-૩૯૫૦૪૦, મો.૯૫૮૬૧ ૩૪૧૮૧ |
| 49 | શ્રી સુર્યકાંત.જી. મોરે-૧૭૫૯૬ | પટાવાળા | સી/૧૩, પુષ્પવાટિકા સોસા., વિદ્યાકુંજ સ્કુલ પાસે, નુતન રો હાઉસની પાછળ, પાલ, સુરત. મો.૯૭૨૭૬ ૮૦૫૨૦ |
| 50 | શ્રી રહીમભાઈ.વાય.ઘોરી- ૧૭૭૪૪ | પટાવાળા | એ-૧૦૩, પ્રથમ માળ, ગુલશને એડુસ, સૈયદપુરા, નવી ચાલ, સુરત , મો..૯૨૨૮૩ ૭૩૯૭૮ |
| 51 | શ્રી ચેતન એસ.દરજી-૩૯૨૯૯ | પટાવાળા | ૪૫, કૃષ્ણકૃપા સોસાયટી, અસ.પી. કુકડીયા સ્કુલની બાજુમાં, પરવટગામ, ગોડાદરા રોડ, સુરત, મો.૯૯૦૯૧ ૪૪૮૦૦ |
| 52 | શ્રી હરીશકુમાર એન.પારઘી -૩૯૩૩૧ | પટાવાળા | બી/૧૩, મધુવન સોસા., ગુલાબવાડીની પાછળ, ડભોલી રોડ, સુરત. મો.૯૯૨૫૭ ૯૪૮૬૭ |
| 53 | શ્રી વિશાલ એચ પટેલ-૩૯૩૩૩ | પટાવાળા | ડી/૧૩૮, વિહલનગર સોસાયટી, હીરાબાગ વરાછા રોડ, સુરત મો.૯૯૨૫૦ ૩૧૩૬૧ |
| 54 | શ્રી વિરાફ એ.દહેણુગરા- ૩૯૪૩૮ | પટાવાળા | બી/૬-૫૦૨, સંસ્કાર રેસીડેન્સી, ન્યુ ક્રોસ રોડ, ઓપ-તો સુર્યાજંલી એપાર્ટમેન્ટ, અમરોલી, સુરત, મો.૯૮૭૯૫ ૯૨૫૪૧, ૯૬૬૪૯ ૩૦૪૨૩ |
| 55 | શ્રી મયુર જે.પટેલ-૩૯૮૯૯ | પટાવાળા | ફાઈવ સ્ટાર મહોલ્લો, પટેલ સ્ટ્રીટ, મગદલ્લા, તા.ચોર્યાસી, જી.સુરત. મો.૯૫૫૮૫ ૦૬૬૦૪, ૯૭૧૨૦ ૯૦૧૪૪ |
| 56 | શ્રી મહેન્દ્ર આર.સોલંકી-૪૦૧૮૩ | પટાવાળા | ૨૪૯, આશાપુરી સોસા. વિ- ૨, પાડેસરા, સુરત-૩૯૪૨૨૦, મો.૯૫૮૬૦ ૩૯૨૧૫ |
| 57 | શ્રી રોબિન્સન આર.કિશ્ચિયન-૪૦૧૮૪ | પટાવાળા | જી ૬ કિશ્ચિયન પાર્ક, મિશન હાઉસ, મુગલીસરા સુરત મો.૯૮૨૫૮ ૮૪૨૮૧ |
| 58 | શ્રી અમિત એમ.સાંરગ-૪૦૪૬૩ | પટાવાળા | જી-૧૭, માધવ નગર, ભીમપોર, પો. ડુમસ, મો.૯૦૩૩૫ ૯૮૦૧૫ |
| 59 | શ્રી પ્રિતમ.પી.સુરતી-૪૧૦૮૮ | પટાવાળા | ૩૦૪-શીવકૃપા સોસાયટી, નીલગીરી રોડ, ગોડાદરા, સુરત. મો.૭૫૬૭૭ ૭૦૪૭૪ |
| 60 | શ્રી સુજય એસ.ડે-૪૨૧૮૮ | પટાવાળા | ૧૧/૨૦૩, સુડા આવાસ, એલ.પી.સવાણી નજીક, પાલ રોડ, સુરત, મો. ૮૧૪૧૨ ૪૧૪૩૭ |
| 61 | શ્રી સચીન બી.સોલંકી-૪૨૩૪૨ | પટાવાળા | પ્લોટ નં.૦૮, બુધ્ધ સોસાયટી, રેલ્વે લાઈબ્રેરીની પાછળ, ઉધના યાર્ડ, સુરત, મો. ૯૫૫૮૯ ૭૬૩૫૭ |

| | | | |
|----|--|------------|--|
| 62 | શ્રી નિમેષ જે. ભગત-૪૩૦૪૯ | પટાવાળા | ઈ-૨૦૨ ભૂમિ કોમ્પલેક્ષ પ્રગતિ મંડળ વાડી , અયોધ્યા નગરી પાસે હનીપાંક રોડ સુરત. મો.૮૪૬૦૮ ૩૭૩૯૫ |
| 63 | શ્રી પ્રજ્ઞેશ જે.પટેલ-૪૪૫૫૭ | પટાવાળા | નિશાળ ફળિયું, નાનાવાઘણીયા, છીત્રાપારડી,તા.:પારડી,જી.:વલસાડ મો.૯૭૨૭૪ ૮૨૭૮૪ |
| 64 | શ્રી જયેશ પી.વાઘેલા-૪૫૫૦૧ | પટાવાળા | બી-૧૦૮, પ્રભુનગર-૧, કતારગામ રોડ, સુરત મો.૯૯૧ ૩૩ ૭૭૪૭૬ |
| 65 | શ્રી કેતન જે.સોલંકી- ૪૫૭૨૨ | પટાવાળા | ૯૩- અભિષેક ટાઉનશીપ વિભાગ - ૨ નવો કોસાડ રોડ, અમરોલી સુરત મો.૭૪૦૫૩ ૨૨૯૬૦ |
| 66 | શ્રી અનિલ એ.નેરકર - ૪૫૭૨૩ | પટાવાળા | એ-૮૦૧, સુમન સેલ, વાઈટ લોટસ સ્કુલની બાજુમાં, વેસુ, સુરત ૩૯૫૦૦૧, મો.૯૦૩૩૧ ૧૦૧૮૫ |
| 67 | શ્રી રાજેશભાઈ આઈ.પટેલ- ૪૮૧૮૭ | પટાવાળા | એલ/૬-બ, પટેલ નગર સોસા., પોલીસ સ્ટેશન ની સામે, જહાંગીરપુરા, સુરત. મો.૯૯૧૩૧ ૩૮૮૩૧ |
| 68 | શ્રી આશિષકુમાર એ.ગામીત- ૪૮૨૮૭ | પટાવાળા | મુ.પો. વાડીભેંસરોટ પારસી ફળિયુ, તા.સોનગઢ, જિ.તાપી- ૩૦૪૬૭૦, મો.૯૯૧૩૧ ૨૧૧૪૦ |
| 69 | શ્રી મયૂર ડી. અટોદરીયા- ૪૮૨૮૮ | પટાવાળા | મુ.પો.સોડગામ, ગર્લ્સ હોસ્ટેલની સામે, સોડગામ, તા.વાલીયા જિ.ભરૂચ.- ૩૯૩૧૩૫, મો. ૮૪૬૯૬ ૪૦૮૦૩ |
| 70 | શ્રી દિપકકુમાર એચ.પડાયા- ૪૮૬૯૭ | પટાવાળા | ૧૧/૨૨૩૧, કોળીવાડ, વરીયાવી બજાર, સુરત. મો.૮૭૫૮૮ ૯૨૫૬૦ |
| 71 | શ્રી વૃષાંકકુમાર એ.કોઠારી- ૪૮૭૨૭ | પટાવાળા | પ/૯૫, ખાંડાકુવા સ્ટ્રીટ, ફાયર સ્ટેશનની પાસે, મોરાભાગળ, રાંદેર રોડ, સુરત મો.૯૨૬૫૬ ૭૮૩૨૧ |
| 72 | શ્રી ઉમેશ એ.અવચાર- ૪૯૨૫૯ | પટાવાળા | ૪૦૨, રાજવીર કોમ્પલેક્ષ, લેપડીયા શેરી, સૈયદપુરા સુરત. મો.૯૯૨૪૧ ૬૮૫૨૭ |
| 73 | શ્રી કૈલાસબેન વી. પટેલ- ૪૯૨૬૮ | પટાવાળા | સી - ૨૦૧, ટાઈમ ગેલેક્સી, ડીમાર્ટ પાસે, જહાંગીરાબાદ, કેનાલ રોડ, સુરત. ૩૯૦૦૦૫. મો.૯૬૦૧૨ ૭૭૩૯૫ |
| 74 | શ્રી નરેશભાઈ ડી.ગીલાતર-૪૯૩૦૨ | પટાવાળા | ૧૩૪૭-ગાયત્રી નગર, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત.-૩૯૫૦૦૪ મો.૯૬૬૪૬ ૧૮૭૨૯ |
| 75 | શ્રી ભાવેશ અરવિંદભાઈ પટેલ- ૪૯૬૯૭ | પટાવાળા | ૧૪૧, હિદાયત નગર સોસા., પાલનપુર, જકાતનાકા, રાંદેર રોડ, સુરત. મો.- ૮૧૪૧૫ ૨૫૫૪૦ |
| 76 | શ્રી હિરેનકુમાર ઉમેદભાઈ પટેલ- ૪૯૬૯૮ | પટાવાળા | ૨૦૨, મુ.પો.ભટલાઈ, ગોળી ફળિયા, તળાવ મહોલ્લો હજીરા, સુરત. મો.૯૯૯૮૯ ૭૦૫૧૬ |
| 77 | શ્રી ચેતનકુમાર મનોજભાઈ પટેલ- ૬૩૦૨૬ | પટાવાળા | ૩૭૯, મહાદેવ નગર -૧, ડીડોલી, ઉધના , સુરત. મો.૭૦૪૬૬ ૯૮૬૧૩ |
| 78 | શ્રી વિનય ચંદ્રકાંત રણપિસે- ૬૩૦૨૭ | પટાવાળા | એ-૨૦૫, સ્વસ્તિક પાર્ક એપાર્ટ.ભૂમી કોમ્પલેક્ષ એપાર્ટ.ની સામે, અયોધ્યા નગરી રોડ, સુરત. ૭૦૧૬૬ ૧૬૪૪૬ |
| 79 | શ્રી ધ્રુવકુમાર દેવજીભાઈ પટેલ - ૭૪૧૨૯ | તા.પટાવાળા | એફ-૧૩, અભિનંદન એપા., અસ્થાન, બારડોલી, સુરત - ૩૯૪૬૦૧, મો.૬૩૫૨૩ ૫૩૫૧૮ |
| 80 | શ્રી જૈમિન નરેન્દ્રભાઈ સેલર -૭૫૦૨૧ | તા.પટાવાળા | ઘર નં-૬, સંજય સોસાયટી, રાંદેર, સુરત-૩૯૫૦૦૫ મો.-૯૬૦૧૫૦૫૪૧૦ |
| 81 | શ્રી રચિત મહેશભાઈ સોલંકી-૭૫૪૭૭ | તા.પટાવાળા | ૨૧૩, સોમનાથ સોસા. આઝાદ નગર ની બાજુમાં ભટાર, અલથાન, સુરત-૩૯૫૦૧૭, મો.-૭૮૭૪૦૪૪૩૬૦ |
| 82 | શ્રી નિતીન ડી. સોલંકી -૭૫૫૫૩ | તા.પટાવાળા | ઘર નં. ૨૯, સંજયનગર સોસાયટી, જહાંગીરપુરા, મોરાભાગળ, સુરત-૩૯૫૦૦૫ મો.-૯૬૬૨૦૪૯૩૪૫ |
| 83 | શ્રી ચંદ્રકાંત એલ. તાંદલેકર- ૧૮૩૨૬ | બેલદાર | રુમ નં. ૫, એસ.એમ.સી. ક્વાટર્સ, નગોરીવાડ, સૈયદપુરા, સુરત-૩૯૫૦૦૩ મો-૮૫૧૧૧૬૫૩૫૧ |

| | | | |
|----|---------------------------------------|------------|---|
| 84 | શ્રીમતી રમીલાબેન કે. ગમાર— ૩૪૭૯૦ | બેલદાર | સી — ૨૦૨, ટાઈમ ગેલેક્સી, ડીમાર્ટ પાસે, જહાંગીરાબાદ, કેનાલ રોડ, સુરત. ૩૯૦૦૦૫ મો. ૮૧૪૧૯ ૬૩૪૫૫ |
| 85 | શ્રી સુનિલ એચ. પટેલ— ૩૫૪૯૯ | બેલદાર | ૫/૧૪૭૧, હરીપુરા, હરીજનવાસ, મેઈનરોડ, સુરત મો. ૯૯૦૯૬ ૪૯૬૨૯, ૯૯૦૯૬ ૪૯૬૩૪ |
| 86 | શ્રી હરેશ એમ. પટેલ— ૩૫૭૪૨ | બેલદાર | ૧૨૩, સુભાષનગર સોસાયટી, ડુંભાલ ટ્રાન્સપોર્ટ ગોડાઉન પાછળ, પૂણાગામ રોડ, સુરત મો. ૯૪૨૬૮ ૭૩૮૮૨, ૯૬૩૮૬ ૪૪૬૬૬ |
| 87 | શ્રી દિનેશ એ. ગીલાતર— ૩૬૯૫૧ | બેલદાર | ૨/૩૭૬૦, ઢબુવાળાની ગલી, નવસારી બજાર, સગરામપુરા સુરત. મો. ૮૪૬૯૬૦૮૪૯૪ |
| 88 | શ્રી ધર્મેશ ડી. પટેલ— ૪૧૦૮૯ | બેલદાર | ૩૦૨, શ્રી નાથજી કોમ્પ્લેક્સ, શ્રી રામ કોલોની, ડભોલી રોડ, સુરત. મો. ૯૮૯૮૫૭૯૧૧૧, ૭૯૯૦૦૭૪૦૪૧ |
| 89 | શ્રી તેજશ એમ. પટેલ— ૪૧૬૮૪ | બેલદાર | મુ. મલગામા, પો. ભૈંસાણ, તા. ચોર્યાસી, જિ. સુરત, મો. ૯૪૨૭૧ ૩૭૭૧૨ |
| 90 | શ્રી નઈમભાઈ. એ. મીરઝા— ૪૨૭૮૬ | બેલદાર | ૧૦, બંભોરા, પોસ્ટ. પીપોદરા, તા. માંગરોળ, જી. સુરત, મો. ૯૫૭૪૧૯૬૦૮૯ |
| 91 | શ્રી હર્ષકુમાર પી. કંથારીયા— ૪૯૩૪૦ | બેલદાર | ૧૨/૨૨૧૬, સૈયદપુરા, એડુસની ચાલ, પ્રણામી મંદિર પાસે, સુરત. મો. ૭૯૯૦૯ ૩૫૨૭૦ |
| 92 | શ્રી નિતિન અમરતભાઈ દાફડા— ૪૯૬૯૬ | બેલદાર | ૮૦૮, બ્લોક નં.— એ, સુમન દર્શન એપાર્ટ, ડી.માર્ટ ની પાછળ, સીંગણપોર, સુરત મો. ૯૫૩૭૫ ૩૮૮૩૧ |
| 93 | શ્રી ઈતિશા નવીનચંદ્ર કોઠારી— ૬૩૧૬૨ | બેલદાર | ૭/૨૭૭૦, ત્રીજો માળ, ફ્લેટ નં. ૩૦૫, શ્રી ક્રિષ્ના કોમ્પ., વાવશેરી, સૈયદપુરા, સુરત—૩૯૫૦૦૩ મો. ૯૫૩૭૨ ૬૨૧૫૮ |
| 94 | શ્રી સ્વપ્નિલ સી. તાંદલેકર — ૭૩૭૯૬ | તા. બેલદાર | રૂમ નં. ૫, એસ. એમ. સી. સ્ટાફ ક્વાર્ટર્સ, નાગોરીવાડ, સૈયદપુરા સુરત. મો.— ૭૬૯૮૧ ૧૫૪૩૪ |

કમ્પ્લેઈન મેનેજમેન્ટ એન્ડ એનાલીસીસ સેલમાં ફરજ બજાવતા કર્મચારીઓની વિગત ૨૦૨૨-૨૩

| અ.નં. | અધિકારી/કર્મચારીનું નામ | કર્મચારી નંબર | હોદ્દો | સરનામું | મો.નં. |
|-------|-----------------------------|---------------|-----------------------|---|------------|
| 1 | શ્રીમતી હેમાંગીની પી. ઠાકોર | ૧૦૮૧૨ | ઓ.એસ. | એ-૨૦૩, આકાશ હોમ્સ, ભાગ્યલક્ષ્મી સોસાયટીની સામે, પીપલોદ, સુરત-૭ | ૯૮૨૫૨૪૦૩૧૪ |
| 2 | શ્રીકેતન. બી. શુક્લ | ૧૨૪૫૫ | પ્રથમ શ્રેણી ક્લાર્ક | ૬, વંદના સોસાયટી, સરદાર બ્રીજ સામે, અડાજણ રોડ, સુરત. | ૯૯૨૫૦૩૯૦૩૮ |
| 3 | શ્રી કિરીટકુમાર આર. ચૌહાણ | ૧૨૯૮૫ | પ્રથમ શ્રેણી ક્લાર્ક | એ-૫૦૧-૫૦૨, પારીજાત એપાર્ટ. મિનાક્ષી વાડી, ખોડીયાર માતા ના મંદિર પાસે., કતારગામ, સુરત. | ૯૪૨૭૧૬૯૧૫૯ |
| 4 | શ્રી નિકિતા આર. પટેલ | ૪૮૦૬૦ | ત્રીજી શ્રેણી ક્લાર્ક | નગર શેઠની વાડી, મોરા ભાગળ ચાર રસ્તા, સુરત-૯ | ૮૨૩૮૯૦૬૪૬૪ |
| 5 | શ્રી અંજના એ. પટેલ | ૪૮૦૬૧ | ત્રીજી શ્રેણી ક્લાર્ક | એ-૪૦, ન્યુ સૌરભ સોસાયટી, એચ.પી પેટ્રોલીયમની સામે, મોરાભાગળ, સુરત. | ૯૭૨૫૨૭૩૩૯૫ |
| 6 | શ્રી હાર્દિક એસ. ભટ્ટ | ૪૮૦૬૨ | ત્રીજી શ્રેણી ક્લાર્ક | એફ-૪૦૩, રાજહંસ રેસીડેન્સી, સુભાષ ગાર્ડન પાસે, જહાંગીરપુરા, સુરત. | ૯૫૫૮૮૦૬૭૧૩ |
| 7 | શ્રી સનિલ એન. કાનફટે | ૪૮૦૬૩ | ત્રીજી શ્રેણી ક્લાર્ક | ૫૮૦, જલારામ નગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ગણેશપુરા, અમરોલી, સુરત. | ૮૧૪૧૬૩૬૩૫૫ |
| 8 | શ્રી જયેશ એમ. મકવાણા | ૪૮૦૬૪ | ત્રીજી શ્રેણી ક્લાર્ક | એ-૬, સસ્વતી સોસાયટી ગેટ નં.૧, શારદા સ્કુલની સામે, ક્રોઝ વે સીંગણપોર રોડ, સુરત. | ૯૪૨૬૦૩૨૩૬૪ |
| 9 | શ્રી ત્રિકમભાઈ ડી. ચારણીયા | ૩૫૭૫૨ | બેલદાર | ૫, પ્રાણનાથ સોસાયટી, વેડ રોડ, સુરત-૪ | ૯૯૧૩૩૭૩૦૭૭ |
| 10 | શ્રી ચિરાગ એમ. પટેલ | ૪૫૨૦૯ | પટાવાળા | મુ.પો.તલાવડી ફળીયુ., નરોડ, મરોલી, જી.નવસારી | ૯૭૨૭૪૯૮૧૮૧ |